

## વેબસાઇટ સંપાદકીય ટીમ તરફથી...

પ્રિય જ્ઞાતિ પરિવાર આપ્તજનો

હજુ તો તે માત્ર ગઈ કાલ જેવું જ લાગે છે, પરંતુ સમય કેવો ઝડપ થી પસાર થાય છે? તમને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે આપણી જ્ઞાતિની વેબસાઇટ શરૂ કર્યા ને જોતજોતા માં એક વરસ પણ પૂરું થઈ ગયું!

ગયા વર્ષે જ્યારે આપણે આ પહેલ શરૂ કરી હતી, ત્યારે આપણા બે મુખ્ય ઉદ્દેશ્યો હતા:

- સ્થળ, ભાષા કે આપણી ઉંમર/પેઢી ના અંતરને દૂર કરીને આપણા તમામ જ્ઞાતિજનોને સાથે લાવવા.
- આપણી જ્ઞાતિ ના વર્તમાન ની અને ભૂતકાળ ની, તમામ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી માટે એક સરળ, સહિયારું સાધન બનાવવું.

આપણે ખુબ જ સંતોષ થી કહી શકીએ છીએ કે આપણી છેલ્લા એક વર્ષની યાત્રા આ બંને ઉદ્દેશ્યો પર ખરેખર ખરી ઉતરી છે.

આ એક વરસ ની યાત્રા માં આપણે કેવા અને કયા પડાવો પસાર કર્યા?

- ✓ જ્ઞાતિજનો દ્વારા આપણી વેબસાઇટની 5,000 થી વધુ મુલાકાતો
- ✓ આપણી લિંક કરેલી YouTube ચેનલ પર 4,000 થી વધુ વ્યૂઝ
- ✓ 5-10 પેઢીઓને આવરી લેતા આપણી જ્ઞાતિના વિવિધ પરિવારોના 8 કૌટુંબિક વૃક્ષો! <http://mccsonline.com/family-trees-gj/>
- ✓ 12 પરિપત્રો અને ઓડિટેડ હિસાબો પ્રકાશિત <http://mccsonline.com/notice-board-gj/>
- ✓ લગ્ન, જનોઈ, સિમંત વગેરે જેવા આપણા શુભ પ્રસંગો માટે 24 પરંપરાગત ગીતો <https://mccsonline.com/આપણા-ગીતો>
- ✓ ડાઉનલોડ વિભાગ હેઠળ 15 ફાઇલો – YouTube અને મીડિયા ફાઇલો સહિત <https://mccsonline.com/તમારા-સંપેતરાં/>
- ✓ 14 વિવિધ કારકિર્દી માર્ગદર્શન લેખો, આપણી જ જ્ઞાતિના યુવક-યુવતીઓના પોતાના સ્વ-અનુભવો <https://mccsonline.com/કારકિર્દી-પરિચય>
- ✓ આપણી જ જ્ઞાતિના ઇતિહાસ પરના 3, સહિત 9 બ્લોગ લેખો <https://mccsonline.com/bloggj/>
- ✓ 11 જાહેરાતો <https://mccsonline.com/classified-ads-gj/>
- ✓ “શું તમે જાણો છો” વિભાગ હેઠળ 9 વિષયો <https://mccsonline.com/didyouknow-gj/>
- ✓ છેલ્લા 3 વર્ષના પંચાંગ <https://mccsonline.com/panchang-gj/>
- ✓ અને સૌથી ખાસ વાત તો: આ તમામ માહિતી ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં, ફક્ત એક મોબાઇલ ફોન માં પણ ઉપલબ્ધ છે!

સ્થળ, ભાષા કે આપણી ઉંમર/પેઢી ના અંતરને ધ્યાનમાં લીધા વિના – આ પ્રવાસમાં આપ સૌ ની ભાગીદારી બદલ આપ નો હૃદયપૂર્વક ખરેખર ખુબ ખુબ આભાર.

આપણી જ્ઞાતિના તમામ ભાઈઓ-બહેનોને તથા આપણા પરિવારોને પરસ્પર જોડવા અને નજીક લાવવાની આ પહેલમાં અમે તમારા સમર્થન અને સક્રિય સહભાગિતાની રાહ જોઈ રહ્યા છીએ. તમે 'આ વેબસાઇટ વિશે' વિભાગ દ્વારા તમારા સૂચનો અથવા કોઈપણ પ્રશ્નો શેર કરી શકો છો અને અમે શક્ય તેટલી ઝડપથી જવાબ આપવાનો પ્રયાસ કરીશું.

આ નવી, લાંબી અને ફળદાયી યાત્રામાં પા-પા પગલી માંડતા, અમે તમારા આશીર્વાદ માંગીએ છીએ.

આપ સૌ ના આભાર અને શુભેચ્છાઓ સાથે

મોહ ચાતુર્વેદિય ચુંથા સમવાય વેબસાઇટ ટીમ.

વિજયા દશમી, 5 Oct 2022